

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સિક્યોર્સ કેનેડા એન્ડ ઓન્ટેરિયો ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન ચિંગકુસી વેલનેસ સેન્ટર (બ્રેમ્પટન ચિંગકુસી વેલનેસ સેન્ટરમાં કેનેડા અને ઓન્ટેરિયો રોકાણો સુરક્ષિત કરે છે)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 9, 2021) – આજે, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown); માનનીય કેથેરિન મેકેન્ના (Catherine McKenna), મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી રૂબી સાહોટા (Ruby Sahota), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન નોર્થ; મનિન્દર સિધુ (Maninder Sidhu), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન ઇસ્ટ; માનનીય લોરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વતી માનનીય પ્રબમીત સરકારિયા (Prabmeet Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ; અને અમરજોત સંધુ (Amarjot Sandhu), મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન વેસ્ટ દ્વારા ચિંગકુસી વેલનેસ સેન્ટરના નવીનીકરણ માટે ભંડોળની ઘોષણા કરવામાં આવી.

ગવર્નમેન્ટ ઓફ કેનેડા ઇન્વેસ્ટિંગ ઇન કેનેડા યોજનાનો ભાગ કમ્યુનિટી, કલ્ચર એન્ડ રિક્વિઝિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (CCRIS) મારફતે આ પ્રોજેક્ટમાં \$572,000 નું રોકાણ કરી રહ્યું છે. ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો \$476,619 નું ભંડોળ, જ્યારે સીટી ઓફ બ્રેમ્પટન \$381,381 નો ફાળો પૂરું પાડી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં પ્રવેશ સુલભતા (એક્સેસિબિલિટી) અને વપરાશકર્તાનો અનુભવ સુધારવા રિક્વિઝિશન સેન્ટરમાં ઇન્ટરિયર અને એક્સ્ટરિયર નવીનીકરણ સામેલ છે. ઇન્ટરિયર આધુનિકીકરણમાં નવા વોશરૂમ્સ, ચેન્જ રૂમ્સ, એક સૌના (sauna), લોકરની સગવડો, અને શાવર સગવડોનો સમાવેશ થાય છે. બધાં વિસ્તારોમાં જમીની ગટર અદ્યતન કરવાની સાથે સાથે, હોટ ટબ વિસ્તારમાં ટાઈલ્સ ફરીથી બેસાડવાથી, આ સગવડની સુરક્ષામાં પણ વધારો થશે.

ઈમારતના એક્સ્ટરિયર પર, વોકવે અને કેચ બેઝિન્સમાં સમારકામથી ઉત્તરી બાજુએ ગટરમાં સુધારો થશે. પાર્કિંગ લોટમાં લાઈટો અદ્યતન કરવામાં વધારે તેજસ્વી, વધારે ઊર્જા-કાર્યક્ષમ ફિક્સચર્સ સમાવવામાં આવશે. ચિંગકુસી વેલનેસ સેન્ટરને અદ્યતન કરવું એ સીટી ઓફ બ્રેમ્પટનના [પાર્કર્સ એન્ડ રિક્વિઝિશન માસ્ટર પ્લાન](#), બ્રેમ્પટનના રિક્વિઝિશન સેન્ટર્સ માટે નવીનીકરણ યોજનાનો ભાગ છે.

ચિંગકુસી વેલનેસ સેન્ટર COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સમગ્ર પ્રોવિન્સમાં શટડાઉનને લીધે અંધ રહ્યું છે. નવીનીકરણ 2021 ની વસંતઋતુમાં શરૂ થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

કડીઓ (લિંક્સ)

- [બ્રેમ્પટનમાં રિક્વિઝિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા કેનેડા અને ઓન્ટેરિયો રોકાણ કરશે](#)
- [પાર્કર્સ એન્ડ રિક્વિઝિશન માસ્ટર પ્લાન](#)

અવતરણો (ક્વોટ્સ):

“અમે બ્રેમ્પટનના ચિંગકુસી વેલનેસ સેન્ટરમાં ગવર્નમેન્ટ ઓફ કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો પાસેથી આ નોંધપાત્ર રોકાણો આવકારવામાં ગૌરવ અનુભવીએ છીએ. બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે અને અમે રહેવાસીઓને તંદુરસ્ત અને સક્રિય રહેવા, અને આનંદ કરાવવા ચિંગકુસી વેલનેસ સેન્ટર અને અમારા બધાં રિક્વિઝિશન સેન્ટર્સ પ્રવેશ સુલભ, સુરક્ષિત અનુભવ કરાવે તેવી ખાતરી કરવાનું ચાલુ રાખીશું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટનના રિક્લિએશન સેન્ટર્સનું આપણું સમુદાયના હૃદયમાં સ્થાન છે. પાર્ક્સ એન્ડ રિક્લિએશન માસ્ટર પ્લાનના ભાગરૂપે ચિંગકુસી વેલનેસ સેન્ટરને અદ્યતન બનાવવામાં સહાયતા બદલ ફંડરલ અને પ્રોવિન્સની સરકારોનો આભાર. ચિંગકુસી વેલનેસ સેન્ટરને અદ્યતન બનાવવાથી બ્રેમ્પટનમાં મનોરંજન સગવડોમાં વધારો થશે અને બધાં બ્રેમ્પટનવાસીઓ માટે સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે.”

- *રોવેના સાન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“ચિંગકુસી વેલનેસ સેન્ટરમાં ઇન્ટરિયર અને એક્સ્ટરિયરને અદ્યતન કરવું એ આ સગવડની પ્રવેશ સુલભતા, સુરક્ષા અને વપરાશકર્તાના એકંદરે અનુભવ માટે અનિવાર્ય છે. અમે આ નવીનીકરણ કામો શરૂ કરવામાં રોમાંચ અનુભવીએ છીએ અને બ્રેમ્પટનમાં ભાવિ પ્રોજેક્ટ્સ પર સરકારના બધાં સ્તરો પાસેથી સતત સહયોગ મેળવવા માટે આશાવાદી છીએ.”

- *શર્મેઇન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સમુદાયને જરૂરી સહાયતા આપવા સરકારના બધાં સ્તરો સાથે કાર્ય કરવા સમર્પિત છે. ચિંગકુસી વેલનેસ સેન્ટરના રોકાણો આપણાં સમુદાયમાં મનોરંજન સગવડોનું નવીનીકરણ કરવા અને બ્રેમ્પટનવાસીઓને ઉત્કૃષ્ટ મનોરંજનલક્ષી તકો પૂરી પાડવા પાર્ક્સ એન્ડ રિક્લિએશન માસ્ટર પ્લાનની વ્યૂહાત્મક પહેલને અનુરૂપ છે.”

- *ડેવિડ બેરિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

“સામુદાયિક મનોરંજન કેન્દ્રોમાં રોકાણ કરવાથી લોકોનું આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન મળે છે અને લોકો જ્યાં રહેવા, કામ કરવા અને કુટુંબીજનોને ઉછેરવા ઇચ્છતા હોય ત્યાં સર્વગ્રાહી અને કાયમી સમુદાયોનું નિર્માણ કરે છે. ચિંગકુસી વેલનેસ સેન્ટરના નવીનીકરણથી બ્રેમ્પટનવાસીઓ માટે મનોરંજનલક્ષી તકો સુધી વધારે સારી પહોંચ પૂરી પડશે. કેનેડાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હજારો પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, દેશભરમાં રોજગારોનું સર્જન કરે છે, અને વધારે સાફ, વધારે સર્વગ્રાહી સમુદાયોનું નિર્માણ કરે છે.”

- *માનનીય કેથેરિન મકેન્ના (Catherine McKenna), મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી રૂબી સાહોટા (Ruby Sahota), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન નોર્થ*

“સમુદાય, સંસ્કૃતિ, અને મનોરંજનલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું એ સર્વગ્રાહી અને કાયમી સમુદાયો બનાવવા માટે અનિવાર્ય છે. ચિંગકુસી વેલનેસ સેન્ટરમાં રોકાણોથી આ સગવડની જીવનરેખા લંબાશે, અને મુલાકાતીઓ આગામી વર્ષો માટે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો આનંદ માણી શકતા હોવાની ખાતરી કરી શકાશે.”

- *મનિન્દર સિધુ (Maninder Sidhu), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન ઈસ્ટ*

“બ્રેમ્પટનની રિક્લિએશન સગવડોમાં આજે રોકાણ કરવાથી ખાતરી થશે કે આપણે આપણાં પ્રેમાળ શહેરનો આનંદ માણવાનું આવતીકાલે પણ ચાલુ રાખી શકીએ છીએ. આપણી સગવડો સુધારીને અને કુટુંબીજનોને સક્રિય રહેવામાં મદદ કરીને, આપણે આ વાવાઝોડાવાળી આબોહવામાં આપણાં સમુદાયને આરોગ્યપ્રદ અને આનંદદાયી રીતો પૂરી પાડી રહ્યાં છીએ.”

- *માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વતી માનનીય પ્રબમીત સરકારિયા (Prabmeet Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ*

“મને ચિંગકુસી વેલનેસ સેન્ટર નવીનીકરણ પ્રોજેક્ટની મંજૂરીની ઘોષણા કરવામાં રોમાંચ થાય છે. આપણાં મહાન શહેરમાં અત્યારે રોકાણથી બ્રેમ્પટનવાસીઓ અને તેઓના કુટુંબીજનોને તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી જીવવા માટે આગળ તકો પૂરી પાડી શકાશે.”

- *અમરજોત સંધુ (Amarjot Sandhu), બ્રેમ્પટન વેસ્ટ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટના સભ્ય*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો લાઈ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ઢુગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

ક્રિસ્ટિન બુજોલ્ડ (Christine Bujold)

પ્રેસ સેક્રેટરી (Press Secretary)

ઓફિસ ઓફ ધી ઓનરેબલ લોરી સ્કોટ, ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર

416-454-1782 | christine.bujold@ontario.ca

સોફિયા સોઝા-ડિઆસ (Sofia Sousa-Dias)

કોમ્યુનિકેશન્સ બ્રાંચ (Communications Branch)

ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Ontario Ministry of
Infrastructure)

437-991-3391 | sofia.sousa-Dias@ontario.ca

મીડિયા રિલેશન્સ (Media Relations)

ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા (Infrastructure Canada)

613-960-9251

ટોલ ફ્રી: 1-877-250-7154

ઇમેલ: infc.media.infc@canada.ca

અમને [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર અનુસરો

વેબ: [ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા \(Infrastructure Canada\)](#)